

જનસંપર્ક અધીકારી દ્વારા  
 પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
 ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
 કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૪/૨/૨૦૧૭ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

અમદાવાદ શહેર પોલીસ તરફથી કરવામાં

આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી:-

સમાચાર યાદી નં.૩૯૩/૧૭

અમદાવાદ શહેર ખાતે અલગ- અલગ પો.સ્ટે. વિસ્તારમાં પોલીસ દ્વારા નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપીઓ અંગે ડ્રાઈવ રાખી સઘન પેટ્રોલીંગ કરી અસરકારક કામગીરી કરતાં ઇસનપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૭૯/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ તથા પાસપોર્ટ એક્ટ કલમ ૧૨(૧)(બી) મુજબના કામના વોન્ટેડ આરોપી નુરહસ્લામ ઐયુબભાઈ શેખ (ઉ.વ.૩૫) (રહે."ડી" વોર્ડ નવાબનગર, ચંડોળા તળાવ શાહઆલમ ઇસનપુર) નાને તા.૨૩/૨/૧૭ નાં કલાક ૨૦/૦૦ વાગે પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.



ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સઘન પેટ્રોલીંગ દરમ્યાન અસરકારક કામગીરી કરતાં ગુજરાત યુનિવર્સિટી ફ.ગુ.ર.નં.૫૪/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૪૬૯, ૧૧૪ મુજબના કામના વોન્ટેડ આરોપી (૧) નિલેષભાઈ યુવરાજભાઈ લવલે (ઉ.વ.૨૪) (રહે. શિવલાલની ચાલી મદ્રાસી મંદિર સામે, ભાઇપુરા, હાટકેશ્વર) અને (૨) સચિનભાઈ સેલ્વરાજ ગવન્ડર (ઉ.વ.૨૩)(રહે.નહેરૂનગર, મદ્રાસી મંદિર સામે, ભાઇપુરા, હાટકેશ્વર) નાને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરી, કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવામાં આવેલ છે.



ખોખરા પોલીસ સ્ટેશન ખાતે સીઆરપીસી કલમ 41 (1)એ મુજબ ના આરોપીઓ (1) નિલેશ યુવરાજ લવલે (2) સચીન સેલ્વરાજ ગવન્ડર રહે ખોખરા અમદાવાદ નાચ્યોને ગુજરાત યુનિવર્સિટી પો.સ્ટે ફુસ્ટ 54/2016 ઈપીકો કલમ 379, 469, 114 મુજબ ના કામે નાસતા ફરતા આરોપીઓ ને પકડી પાડેલ છે

સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નાસતો-ફરતો આરોપી રાજેશ કાળીદાસ સોલંકી (દરજી) ઉર્ફે રાજુ સોલંકી (ઉ.વ.૪૭)(રહે.હનુમાનની પોલ, અલીંગ ચાર રસ્તા, ખંભાત જી.આણંદ) સને ૨૦૧૨ માં કાઇમબ્રાન્ચ સેકન્ડ ગુ.ર.નં.૩૦૬૬/૨૦૧૨ ધી આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧)બી.એ નાં કામનો નાસતો ફરતો હતો તેમજ સને ૨૦૧૫ એલીસબ્રીજ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૮૯/૧૫ ઇપીકો કલમ ૪૦૬,૪૨૦,૫૦૭, ૧૧૪ મુજબનાં કામમાં પણ નાસતો ફરતો હતો. જેને તા.૨૩/૨/૧૭ નાં કલાક ૨૧/૦૦ વાગે પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.



## દાણીલીમડા પોલીસ સ્ટેશન :

(ઘોરફોડ ચોરીના આરોપીઓ- ૬ પકડયા)

મુદ્દામાલ રૂ. ૧૮,૦૦,૦૦૦/-

નાયબ પોલીસ કમિ.શ્રી ઝોન-૬ અમદાવાદ શહેર સાહેબ તેમજ મ.પો.કમિ.શ્રી ' કે ' ડીવીઝન અ'વાદ શહેરનાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ દાણીલીમડા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં-૩૬/૨૦૧૭ ઇપીકો કલમ-૪૫૪, ૪૫૭,૩૮૦ મુજબનો બનેલ ગુનો શોધી કાઢવા સારુ સીની.પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એન.કે.ગોસ્વામી તથા સર્વે.સ્કોડ સ્ટાફના માણસો પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં નિકળેલ તે દરમિયાન સાથેના સ્ટાફના પો.કો.નસરૂલાખાન હબીબખાન બ.નં.૯૭૧૦ તથા હેડ.કોન્સ.કાનજીભાઈ અમીભાઈ બ.નં. ૭૭૯૦ નાઓને મળેલ ખાતમી હકિકત આધારે આરોપીઓ (૧)મુકીમભાઈ બાબુદીન પઠાણ ઉવ.૪૦ રહે.શોપ નં ૬/૩, આબાદ એસ્ટેટ, કાશીરામ ટેક્સટાઈલ પાસે, ઓફે ટીમબર નારોલ અમદાવાદ શહેર મુળ વતન ગામ પીલખતા તા:અકરાબાદ થાના અકરાબાદ જીલ્લો અલીગઢ ઉત્તરપ્રદેશ (૨)હુમાયુ હનીફભાઈ પાનવાલા ઉવ.૩૭ રહે. મ.નં.૩૩૫૪ દાસ્તાન ગલી,નવી મસ્જીદ છીપાવાડ, જમાલપુર, અમદાવાદ શહેર (૩)મોહમદ શહેઝાદ ફારૂકભાઈ તેલવાલા (છીપા) ઉવ.૨૩ રહે.મ.ન ૧૮૬૬, જમાલપુર ચકલા, બાવાજીની પોળ, એફ.ડી. પ્રાઈમરી સ્કુલ સામે, જમાલપુર, અમદાવાદ શહેર (૪) રીઝવાન રફીકખાન પઠાણ ઉવ.૨૦ રહે. સોનલ ફેક્ટરી સામે, નુરનગર, તન્જીમ પાર્ક સામે નારોલ વટવા રોડ, વટવા, અમદાવાદ શહેર (૫) યાસીનભાઈ જફરભાઈ સૈયદ ઉવ.૨૦ રહે. સોનલ ફેક્ટરી સામે, તન્જીમ પાર્ક નારોલ વટવા રોડ,વટવા, અમદાવાદ શહેર (૬) અમજદ હાફીઝભાઈ મેવ ઉવ.૨૪ રહે. સોનલ ફેક્ટરી સામે, નુરનગર, તન્જીમ પાર્ક સામે નારોલ વટવા રોડ, વટવા, અમદાવાદ શહેરનાઓને આ ગુનાના કામે ચોરી કરેલ પુરેપુરા મુદ્દામાલ સાથે માલ સગેવગે કરવા જતા ચોરી કરેલ જીન્સના કાપડના રોલ નંગ-૯૫ કિ.રૂ.૧૨,૦૦,૦૦૦/-તેમજ ટ્રક નં.G.J.01 BT 8068 કિ.રૂ.૬,૦૦,૦૦૦/ મળી કુલ રૂ.૧૮,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી લઈ દાણીલીમડા પો.સ્ટે.નો ઉપરોક્ત ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢેલ છે.



નાયબ પોલીસ કમિશનર  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.